

મે. પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં, મુ. પાલિતાણા.

સમરી સ્યુટ નં.-૨૭/૨૦૨૩.

આંક-૧ લગત હુકમ :-

(૧) વાદીના દાવાની ટુંકમાં હકીકત જોવામાં આવે તો, તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે બેન્કીંગને લગતુ કાર્ય કરે છે. વાદી નેશનલાઇઝ બેન્ક હોઇ, પ્રતિવાદીને શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના સ્વ-રોજગાર લોન સહાય(મુદ્રા લોન) માટે રૂ.૧,૨૮,૦૦૦/-ની લોન આપેલ, જે રકમ ૧૦.૭૫%ના વ્યાજ સાથે પ્રતિવાદી પાસેથી વસૂલ મેળવવા તથા પ્રતિવાદી જો તેમ કરવામાં કસૂર કરે તો, તા.૨૭/૮/૨૦૨૩ સુધીના વ્યાજસહિતની રકમ રૂ.૬૫,૪૨૮/-પ્રતિવાદીની જાત તથા દરેક પ્રકારની મિલકતમાંથી સદર રકમ વસૂલ મેળવવા હુકમનામુ મેળવવા તેમજ સદર દાવાનો તમામ ખર્ચ પ્રતિવાદી પાસેથી અપાવવા તેઓ(વાદી) એ વિનંતી કરેલ છે.

(૨) આ કામના પ્રતિવાદીને દાવાના સમન્સ(આંક-૫)ની યોગ્ય બજવાણી થવા છતાં, તેઓ દાવાના કામે હાજર થયેલ નહી. ત્યારબાદ, પ્રતિવાદી અત્રેની અદાલતમાં હાજર ન રહેતા, તેઓનો લીવ ટુ ડિફેન્સની અરજી કરવાનો હક્ક રહેતો ન હોઇ, વાદીના વિ.વ.શ્રી એ આંક-૬થી સમન્સ ફોર જજમેન્ટનો હુકમ કરવા અરજી આપેલ, જે અરજી હેઠળ પ્રતિવાદી તરફે કોઈ એપીયરન્સ ન હોઇ, અત્રેની અદાલત દ્વારા તા.૧૫/૩/૨૦૨૪ના રોજ પ્રતિવાદી સામે સમન્સ ફોર જજમેન્ટ ઇશ્યુ કરવા હુકમ કરવામાં આવેલ. આમ વાદીએ, અત્રેની અદાલતમાં સમરી દાવો કરેલ હોય તે અન્વયે, પ્રતિવાદીએ લીવ ટુ ડિફેન્સની કોઈ અરજી આપેલ ન હોઇ, વાદી તેમની દાવા અરજી અન્વયે હુકમનામુ મેળવવા હક્કદાર બને છે.

(૩) વાદી બેન્કે પ્રતિવાદીને રૂ.૧,૨૮,૦૦૦/-ની લોન આપેલ હોવા અંગે વાદી બેન્કના અધિકૃત અધિકારી/મેનેજર દ્વારા આંક-૪ના ડી.ઇ.લિસ્ટથી આંક-૮થી પ્રતિવાદી એ ધિરાણ મેળવવા કરેલ અરજી, આંક-૯થી લેટર ઓફ એરેન્જમેન્ટ, આંક-૧૦થી હાયપોથીકેશન એગ્રીમેન્ટ, આંક-૧૧થી ઇન્ટરવ્યુ-કમ-અપ્રેઇઝલ ફોર્મ તેમજ આંક-૧૨થી અસલ ક્વોટેશન બિલ રજૂ કરેલ છે. આમ, વાદી બેન્ક તરફે રજૂ સદર તમામ દસ્તાવેજો પરથી તા.૨૭/૮/૨૦૨૩ સુધીમાં રૂ.૬૫,૪૨૮/-પ્રતિવાદી પાસેથી લેણા પડતા હોવાનું સાબિત થાય છે. વધુમાં, તેઓએ લોન લેતી વખતે જરૂરી દસ્તાવેજો જેવા કે કરારો, એકરારનામું, કબુલાતનામું, તારણ વિ. ડોક્યુમેન્ટસ સ્વ-હસ્તાક્ષરમાં સહીઓ કરી આપેલ. પ્રતિવાદી એ લોન લીધા બાદ, નિયત સમયમર્યાદામાં તેઓએ લોનના હપ્તા ભરેલ ન હોઈ, વાદી બેન્ક દ્વારા તેઓને વકીલ મારફત નોટીસ મોકલવા છતાં, પ્રતિવાદીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નથી. આ સંજોગોમાં, પ્રતિવાદીએ લોન-કરાર મુજબની વ્યાજસહિતની રકમ વસુલ આપેલ ન હોઈ, તેમણે હાલનો દાવો કર્યો છે. વધુમાં, વાદીએ તેમના દાવામાં પ્રતિવાદી પાસેથી લેણી રકમ ઉપર ૧૦.૭૫% વ્યાજની માંગણી કરેલ છે, તે મુજબ પ્રતિવાદી વાદીને લેણી રકમની ચુકવણી કરે તો, તે ન્યાયોચિત રહેશે તેવું માનવું છે જેથી, નીચે મુજબનો આખરી હુકમ ફરમાવવામાં આવે છે.

—:(હુ ક મ):—

- વાદીનો દાવો આથી, **મંજૂર** કરવામાં આવે છે.
- પ્રતિવાદીએ લોન-ધિરાણના બાકી લેણા પેટે વાદીને રૂ.૬૫,૪૨૮/- (અંકે રૂપિયા પાંસઠહજાર ચારસો ઓગણત્રીસ પુરા) વસુલ થતા સુધી ૧૦.૭૫%ના દરે વ્યાજસહિત ચૂકવી આપવા.
- જો પ્રતિવાદી વાદી કંપનીની લેણી રકમ વસૂલ આપવામાં કસૂર કરે તો વાદી પ્રતિવાદી ની જાત તથા તમામ મિલકતથી સદરહું લેણી રકમ વસૂલ મેળવવા હક્કદાર રહેશે તેવું આથી ઠરાવવામાં આવે છે.

➤ પ્રતિવાદીએ આ દાવાનો ખર્ચ વાદીને ચૂકવી આપવો.

➤ હુકમ મુજબ હુકમનામુ દોરવુ.

હુકમ આજ તારીખ-૧૦, માહે-મે, સને-૨૦૨૪ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી
—સંભળાવી, જાહેર કર્યો.

સ્થળ:પાલિતાણા.

(મેહુલ યોગેશભાઈ વ્યાસ)
પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ—પાલિતાણા.
(કોડ નં.—જી.જે.૦૧૦૮૨).

એચ.બી.જોષી(પી.એ.).